

15<sup>th</sup> February, 2023

To,  
**Department of Corporate Services**  
**BSE Limited**  
Ground Floor, P. J. Tower,  
Dalal Street, Fort,  
Mumbai - 400 001

Security ID: GNRL

Security Code: 513536

Dear Sir/Madam,

**Sub: Copy of Advertisement of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter and nine months ended on 31/12/2022.**


Please find enclosed herewith copy of advertisement of Unaudited Financial Results (Standalone & Consolidated) for the quarter and nine months ended on 31<sup>st</sup> December, 2022 as per Regulation 47(1)(b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Kindly take the same on your record.

Thanking You.

Yours faithfully,

**For, Gujarat Natural Resources Limited**



**Shalin A. Shah**  
**Managing Director**  
**DIN: 00297447**



Encl: As above

**Gujarat's MMR drops steadily over last five years**

Gandhinagar: The maternal mortality rate (MMR) in Gujarat has been dropping steadily in Gujarat over the last five years, reflecting an improvement in risk associated with pregnancy among women. Figures provided by the Union government in the ongoing budget session of parliament said that according to the sample registration system (SRS) figures, the MMR in Gujarat fell from 87 in SRS 2015-17 to 57 in SRS 2018-

20. MMR is defined as the number of maternal deaths per 100,000 live births due to pregnancy or termination of pregnancy. The maternal mortality rate is used to represent the risk associated with pregnancy among women.

However, since the benchmark of 70 is set for the year 2023, Gujarat is still far from achieving it. The Union government has set a target of 70 for the year 2023. Gujarat is still far from achieving it. The Union government has set a target of 70 for the year 2023. Gujarat is still far from achieving it.

**Kerala Tourism revamps its strategy to woo travellers**



Ahmedabad, Buoyed by a clutch of global awards and accolades, Kerala Tourism will unleash a raft of new projects and events that will turn the state into an all-season destination and make the stay of new-age travellers a learning, rejuvenating and relaxing experience by unfolding before them the captivating charm of rural hinterland and lesser-known places. For Kerala Tourism, 2022 was a year of remarkable achievements and inspiring global and national honours.

'Aymanam village' as one of the '50 Extraordinary Destinations to explore in 2022'. Conde Nast Traveller recognized Kerala's

**Latest innovations and high-quality raw materials to unlock the Indian ceramic industry's potential at Indian Ceramics Asia 2023**

Ahmedabad, India is one of the fastest-growing ceramic tile marketplaces. Its ceramic industry ranks third in the world in terms of production. Though there are several large companies in the ceramics sector, the industry is majorly dominated by unorganized players with approximately 60% of the market share belonging to the SMEs. The Rs. 26,500-crore Indian ceramic tile industry

is expected to grow at a CAGR of around 9 percent in the next few years. Indian Ceramics Asia is India's leading annual trade fair and conference for the ceramic and brick industry. The upcoming edition of Indian Ceramics Asia 2023 will see participation from leading companies such as Hindalco Industries, HLT Industry, Imerys Ceramics India, Keda Industrial Group, Lamberti India, Modena

Technology, Monte-Bianco Diamond Applications, Prism Johnson, Projecta Engineering SRL, Sacmi Engineering, Sukaso Ceracolors, System Ceramics India, and many more showcasing a wide range of ceramics and brick latest machinery, high-quality raw materials, analysis and laboratory equipment, technical ceramics, equipment for storage, material handling, etc. (20-4)

**HDFC Housing Development Finance Corporation Ltd. POSSESSION NOTICE**

Branch Address : HDFC House, Trident, Race Course, Vadodra-390007. Tel. : 0265-6480799

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.	Date of Demand Notice	Date of Possession Physical/Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	Mr. JAY JAYESHBHAI PANCHAL (BORROWER)	Rs.18,79,51- as on 30/09/2019*	27 May, 2023	10 Feb, 2023	B-31, NANDANBAUG BUNGLOWS, BH, AMBA ASHRAM, COLLEGE ROAD, NADAD, 387001.

With further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation. \*However, since the benchmark of 70 is set for the year 2023, Gujarat is still far from achieving it. The Union government has set a target of 70 for the year 2023. Gujarat is still far from achieving it.

Regd. Office: Ramon House, H T Parekh Marg, 169, Backbay Reclamation, Churghate, Mumbai-400020. Corporate Identity Number : CIN : L71010MH1977P1C09116. E-mail : customer.service@hdfc.com. Website : www.hdfc.com

Public Notice: NOTICE is hereby given that certificate(s) Nos 584842, 595571. For 100, 200 Shares bearing Distinctive Nos. 49175681 - 49175700, 49209825 - 49209854 under file No. 16014414. Standing in the name(s) of Vajubhai Jivabhai Pali in the Books of Net Profits (Losses) for the period before tax (after Exceptional and/or Extraordinary items) of Rs. 1,76,33,000/- (One crore and seventy six lakh and thirty three thousand only).

**GUJARAT NATURAL RESOURCES LIMITED**

Regd. Office : 3rd Floor, A Wing, Gopal Palace, Opp. Ocean Park, Nr. Nehru Nagar, Satellite Road, Ahmedabad-380015. CIN : L27100GJ1991PLC016158

PARTICULARS	Quarter ended		Previous Quarter ended		Corresponding months ended in the previous year	Year to date
	31-12-2022	30-09-2022	31-12-2021	30-09-2021		
Total Income from operations	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-325.83	-225.67	-	-	-150.00	-984.82
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-197.71	-118.55	-207.38	-	-492.03	-
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-197.71	-118.55	-207.38	-	-492.03	-
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	-197.71	-118.55	-207.38	-	-492.03	-
Equity Share Capital (after tax)	8025.16	8025.16	8025.16	8025.16	8025.16	8025.16
Other Equity	-	-	-	-	-	-
Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	-0.25	-0.15	-0.26	-	-0.28	-0.61
Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each) (not annualized)	-0.25	-0.15	-0.26	-	-0.28	-0.61
Diluted	-0.25	-0.15	-0.26	-	-0.28	-0.61

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2022**

PARTICULARS	Quarter ended		Previous Quarter ended		Corresponding months ended in the previous year	Year to date
	31-12-2022	30-09-2022	31-12-2021	30-09-2021		
Total Income from operations	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-17.63	-8.80	-3.07	-	-40.60	-
Net Profit after tax	-17.63	-8.80	-3.07	-	-40.60	-

Date: 14/02/2023. Place: Ahmedabad. For, GUJARAT NATURAL RESOURCES LTD. SHALIN A. SHAH, MANAGING DIRECTOR, DIN: 00297447

**Form No INC-26**

BEFORE THE CENTRAL GOVERNMENT THROUGH REGIONAL DIRECTOR, NORTH WESTERN REGION, AHMEDABAD, GUJARAT

In the matter of sub-section (4) of Section 13 of the Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

AND In the matter of MEREDITH TRADERS PRIVATE LIMITED (CIN: U47300GJ1989PT0067335), having its registered office at 409 Shyamk Complex, BH, Kandhenu Complex, Nr. Parjara Pole, Polytechnic, Ahmedabad - 380015 Gujarat.

By Order of the Board FOR MEREDITH TRADERS PRIVATE LIMITED. Sd/-: Nishant Mittal, Director. DIN: 00352261. Date: February 15, 2023

**Form No INC-26**

BEFORE THE CENTRAL GOVERNMENT THROUGH REGIONAL DIRECTOR, NORTH WESTERN REGION, AHMEDABAD, GUJARAT

In the matter of sub-section (4) of Section 13 of the Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

AND In the matter of JINDAL COATED STEEL PRIVATE LIMITED (CIN: U27206GJ1989PT073209), having its registered office at 409 Shyamk Complex, BH, Kandhenu Complex, Nr. Parjara Pole, Polytechnic, Ahmedabad - 380015 Gujarat.

By Order of the Board FOR JINDAL COATED STEEL PRIVATE LIMITED. Sd/-: Sanjeev Doshi, Director. DIN: 00352281. Date: February 15, 2023

**Form No INC-26**

BEFORE THE CENTRAL GOVERNMENT THROUGH REGIONAL DIRECTOR, NORTH WESTERN REGION, AHMEDABAD, GUJARAT

In the matter of sub-section (4) of Section 13 of the Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

AND In the matter of MALWA CHROME PRIVATE LIMITED (CIN: U47300GJ1989PT0068855), having its registered office at 409 Shyamk Complex, BH, Kandhenu Complex, Nr. Parjara Pole, Polytechnic, Ahmedabad - 380015 Gujarat.

By Order of the Board FOR MALWA CHROME PRIVATE LIMITED. Sd/-: Nishant Mittal, Director. DIN: 00352261. Date: February 15, 2023

**Form No INC-26**

BEFORE THE CENTRAL GOVERNMENT THROUGH REGIONAL DIRECTOR, NORTH WESTERN REGION, AHMEDABAD, GUJARAT

In the matter of sub-section (4) of Section 13 of the Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation) Rules, 2014

AND In the matter of DHAMAN KHOL ENGINEERING & CONSTRUCTION COMPANY PRIVATE LIMITED (CIN: U45201GJ1986PT0085585), having its registered office at 409 Shyamk Complex, BH, Kandhenu Complex, Nr. Parjara Pole, Polytechnic, Ahmedabad - 380015 Gujarat.

By Order of the Board FOR DHAMAN KHOL ENGINEERING & CONSTRUCTION COMPANY PRIVATE LIMITED. Sd/-: Nishant Mittal, Director. DIN: 09222379. Date: February 15, 2023

**PUROHIT CONSTRUCTION LIMITED**  
CIN : L45200GJ1991PLC015878  
REGD.OFFICE:401,PUROHIT HOUSE,OPP:STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009  
Telephone Number- 079-6662104, Email Id: cs@purohitconstruction.com  
Website:www.purohitconstruction.com

**Statement of Standalone unaudited Financial Results for the Quarter & Nine Months Ended on 31st December, 2022**

Sl.No.	Particulars	Three Months ended		Nine Months Ended		Year ended
		31/12/2022	31/12/2021	31/12/2022	31/09/2022	
1.	Total Income from Operations	0.000	0.000	45.000	0.000	25.000
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(47.477)	(16.371)	(79.752)	(59.617)	(74.643)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(47.477)	(16.371)	(79.752)	(59.617)	(74.643)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(47.746)	(16.491)	(80.337)	(59.980)	(75.125)
5.	Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(47.746)	(16.491)	(80.337)	(59.980)	(75.125)
6.	Equity Share Capital (Equity Shares of Rs.10/-Each)	440.560	440.560	440.560	440.560	440.560
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.000	0.000	0.000	0.000	(128.280)
8.	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	(1.084)	(0.374)	(1.824)	(1.363)	(1.705)
	Diluted:	(1.084)	(0.374)	(1.824)	(1.363)	(1.705)

Notes: 1. The Above Financial Results have been reviewed by the Audit committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 14/02/2023. 2. The above result for the quarter and nine months ended on 31.12.2022 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (Ind AS), prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. 3. The Limited Review of Unaudited Financial Results for the Quarter and Nine Months ended December 31, 2022 as required in terms of Clause 33 of SEBI (LODR) Regulations, 2015 has been carried out by Statutory Auditors. 4. The Figures pertains periods have been regrouped, reclassified and restated wherever necessary. 5. The above financial results are available on the Company's website www.purohitconstruction.com and also on the website of BSE (www.bseindia.com)

Place : Ahmedabad Date : 14/02/2023 For and on behalf of the Board of Directors NARENDRA M. PUROHIT (Chairman & Managing Director) DIN:00755195

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2022**

Sr. No.	Particulars	STANDALONE		CONSOLIDATED	
		Quarter ended December 31, 2022 (unaudited)	Nine Months Ended December 31, 2022 (unaudited)	Quarter ended December 31, 2021 (unaudited)	Nine Months Ended December 31, 2021 (unaudited)
1.	Total income from operations	3404.82	10210.86	3093.88	3496.59
2.	Net Profit for the period (before tax, exceptional and for extraordinary items)	31.25	795.08	473.33	-336.69
3.	Net Profit for the period before tax (after exceptional and for extraordinary items)	31.25	795.08	473.33	-336.69
4.	Net Profit for the period after tax (after exceptional and for extraordinary items)	25.13	581.94	314.21	-322.54
5.	Total Comprehensive Income for the period (comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	21.19	600.48	361.80	-326.47
6.	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each) as shown in the Audited Balance Sheet of the previous year	2516.03	2516.03	2516.03	2516.03
7.	Earnings Per Share (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.10	2.36	1.41	-1.28
8.	Diluted:	0.10	2.36	1.41	-1.28

\* Reserves for the year ended March 31, 2022 were Standalone Rs. 6621.42 lakhs and Consolidated Rs. 6446.65 lakhs. Note: The above is an extract of the detailed format of Quarterly Year-to-Date Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Year to Date Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.zotahelthcare.com. 2. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on February 13, 2023. 3. The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

Date: 14.02.2023 Place: Surat For and on behalf of the Board of Directors of Zota Health Care Limited. Sd/-: Moxesh Zota (Managing Director) DIN: 07623119

**GLOBE TEXTILES (INDIA) LIMITED**  
CIN: L65910GJ1995PLC027673

(Regd. Office: Plot No. 38 to 41, Ahmedabad Apparel Park, GIDC Khokhra, Ahmedabad, Gujarat - 380008) E-mail id: cs@globetextiles.net | website: www.globetextiles.net Contact No: 0091-79-22931881 to 1885

**Extract of Unaudited Financial Results for the quarter and nine months ended on December 31, 2022**

Particulars	Quarter Ended on		Nine Months Ended on		Quarter Ended on
	31.12.2022	31.12.2021	31.12.2022	31.12.2021	
Total Income from operations	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	66.18	483.10	194.83	-	-
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	66.18	483.10	194.83	-	-
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	47.61	374.13	137.95	-	-
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	50.12	381.67	143.91	-	-
Equity Share Capital	3022.83	3022.83	3022.83	-	-
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)	2.00	2.00	2.00	-	-
Basic:	0.03	0.25	0.09	-	-
Diluted:	0.03	0.25	0.09	-	-

Notes: 1. The unaudited financial results for the quarter and nine months ended on December 31, 2022, have been reviewed by the Audit Committee on February 13, 2023, thereafter approved and taken on record by the Board of Directors. The Statutory Auditors of the Company have conducted a "Limited Review" of the above unaudited standalone financial results for the quarter and nine months ended December 31, 2022. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.globetextiles.net) and on the website of NSE Ltd (www.nseindia.com). 3. Exceptional and/or extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

Date: 13/02/2023 Place: Ahmedabad For, GLOBE TEXTILES (INDIA) LIMITED Sd/-: Bhavik Suryakant Parikh (Managing Director) (DIN: 00038223)

